

અરબી-ગુજરાતી

કુરઆને મજીદ

પારા-૧૫

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાયોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

www.hajinaji.com

● [LIKE US ON FACEBOOK](#) ●

[HOME](#) | કુરઆને મજીદ (પારા-૧૫) -1 | [VISIT US](#)

નોંધ.....

→ વધુ કિતાબો ડાઉનલોડ કરવા માટે www.hajinaji.com પર લોગ ઓન કરો.

→ કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય તો જાણ કરવા વિનંતી.

hajinajitrust@gmail.com

અનુક્રમણિકા

| નં. | સૂરાનું નામ | પેજ |
|-----|------------------------------------|-----|
| ૧૭ | સૂર-એ-બની ઈસરાઈલ (આયત ૧ થી ૧૧૧) | ૪ |
| ૧૮ | સૂર-એ-કહફ (આયત ૧ થી ૭૪) | ૭૮ |

سورة الإسراء / સૂરચે બની ઈસરાઈલ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી (શરૂ કરું છું) જે ઘણો મહેરબાન
(કૃપાળુ), બહુજ રહેમ (દયા) વાળો છે.

سُبْحَانَ الَّذِي أَسْرَى بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى
الْمَسْجِدِ الْأَقْصَا الَّذِي بَرَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا إِنَّهُ
هُوَ السَّمِيعُ الْبَصِيرُ ①

(૧) પાક છે તે જાત કે જે રાતો રાત પોતાના બંદા
(મોહમ્મદ સ.અ.વ.)ને મસ્જિદુલ હરામ
(બયતુલ્લાહ)થી મસ્જિદે અકસા (બયતુલ મુકદ્દસ)
તરફ લઈ ગયો જેની આસપાસ (ની ભૂમિ)ને ખુદ

અમોએ બરકતવાળી બનાવી છે કે જેથી અમે તેને
અમારી નિશાનીઓમાંથી કેટલીક દેખાડી દઈએ;
બેશક તે મોટો સાંભળનાર (અને) દેખનારો છે.

وَأَتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَاهُ هُدًى لِّبَنِي إِسْرَائِيلَ أَلَّا
تَتَّخِذُوا مِن دُونِي وَكِيلًا ۝

(૨) અને મૂસાને અમોએ (તૌરેત) કિતાબ આપી
હતી અને તેને બની ઇસરાઇલ માટે હિદાયત
(સન્માર્ગ દર્શક) બનાવી હતી (અને સાથેજ એવી
આજ્ઞા પણ કરી હતી) કે મારા સિવાય કોઈને પણ
કાર્યસાધક બનાવો નહિ.

ذُرِّيَّةً مِّنْ حَمَلِنَا مَعَ نُوحٍ ۖ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا ۝

(૩) (આ બની ઇસરાઇલ) તે (લોકો)ની ઔલાદ હતી કે જેમને અમોએ નૂહની સાથે કશ્તીમાં સવાર કરાવ્યા હતા; નિઃસંશય તે (નૂહ) અતિશય આભાર માનનારો બંદો હતો.

وَقَضَيْنَا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ
مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا ﴿٣﴾

(૪) અને અમોએ એજ કિતાબ (તોરેત)માં બની ઇસરાઇલને ખબર આપી હતી કે તમે પૃથ્વી પર બે વખત અવશ્ય ફસાદ કરશો અને (વળી) ખરેજ મોટી ઉધ્ધતાઇ સાથે વર્તશો.

فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَنَا أُولَىٰ بَأْسٍ
شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ ۗ وَكَانَ وَعْدًا مَّفْعُولًا ﴿٥﴾

(૫) પછી જ્યારે બે વાયદાઓ માંના પહેલાનો સમય આવ્યો ત્યારે અમોએ તમારી વિરુદ્ધ અમારા મહાન યોધા મોકલી દીધા જેથી તેઓ શહેરના અંદરના ભાગમાં ફરી વળ્યા; અને (અમારો અઝાબનો) વાયદો પૂરો થનાર હતો તે થઈને રહ્યો.

ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَأَمْدَدْنَاكُمْ بِأَمْوَالٍ وَبَنِينَ
وَجَعَلْنَاكُمْ أَكْثَرَ نَفِيرًا ﴿٦﴾

(૬) પછી અમોએ તમને તેમના પર પાછી પ્રબળતા આપી અને સંપત્તિ અને સંતતિ વડે તમારી સહાય કરી અને સંખ્યાની રૂએ પણ તમને ઘણા વધારી દીધા.

إِنْ أَحْسَنْتُمْ أَحْسَنْتُمْ لِأَنْفُسِكُمْ وَإِنْ أَسَأْتُمْ فَلَهَا ط

فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوءَ أَوْجُوهَكُمْ وَلِيَدْخُلُوا

الْمَسْجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وَلِيُتَبِّرُوا مَا عَلَوْا تَتْبِيرًا ④

(૭) અગર તમે કોઈ નેકી કરશો તો તમારા પોતાના (લાભ) માટેજ નેકી કરશો, અને જો તમે બદી કરશો તો તે પણ તમારા પોતાના માટેજ કરશો. પછી જ્યારે બીજા વાયદાનો (સમય)

આવ્યો (ત્યારે અમોએ બીજા લોકોને મોકલ્યા) કે
 (જેથી તમને શિક્ષા કરી) તેઓ તમારા મોંઢા
 બગાડી નાખે તથા મસ્જિદમાં એવી રીતે ઘુસી
 જાય કે જેવી રીતે પ્રથમ વાર તેઓ તેમાં ઘુસી
 ગયા હતા. અને પછી તેમનું જે જે વસ્તુઓ પર
 જોર ચાલે તેને ભાંગી તોડી સંપૂર્ણ નાશ કરી નાખે.

عَسَىٰ رَبُّكُمْ أَن يَرْحَمَكُمْ ۚ وَإِنْ عُدتُّمْ عُدْنَا ۗ وَجَعَلْنَا

جَهَنَّمَ لِلْكَافِرِينَ حَصِيرًا ﴿٨﴾

(૮) (પરંતુ) સંભવિત છે કે તમારો પરવરદિગાર
 તમારા પર દયા કરે, અને અગર તમોએ પછી
 પણ એજ (નાફરમાની તરફ મોઢું) કર્યું તો અમે

પણ એજ કરીશું; અને અમોએ (સત્યનો) ઇન્કાર
કરનારાઓ માટે જહન્નમને કૈદખાનું બનાવ્યું છે.

إِنَّ هَذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ
الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا ۝

(૯) બેશક આ કુરઆન તે માર્ગ દેખાડે છે કે જે
સૌથી સીધો છે અને તે મોઅમીનોને કે જેઓ
નેકીઓ કરતા રહે છે આ ખુશખબર સંભળાવે છે કે
તેમના માટે ઘણો મોટો બદલો છે.

وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا ۝

(૧૦) અને આ કે જેઓ આખેરત ઉપર ઇમાન નથી રાખતા તેમના માટે ખરેખર અમોએ દુઃખદાયક અઝાબ તૈયાર કર્યો છે.

وَيَدْعُ الْإِنْسَانَ بِالشَّرِّ دُعَاءَهُ بِالْخَيْرِ ط وَكَانَ الْإِنْسَانُ
عَجُولًا ۝

(૧૧) અને ઇન્સાન બૂરી વસ્તુઓ માટે પણ એવી દુઆ માંગે છે જેવી કે સારી વસ્તુ માટે; અને ઇન્સાન અતિ ઉતાવળો છે.

وَجَعَلْنَا اللَّيْلَ وَالنَّهَارَ آيَاتَيْنِ فَمَحْوَنًا آيَةَ اللَّيْلِ وَجَعَلْنَا آيَةَ
النَّهَارِ مُبْصِرَةً لِّتَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ وَلِتَعْلَمُوا عَدَدَ
السِّنِينَ وَالْحِسَابِ ط وَكُلَّ شَيْءٍ فَصَّلْنَاهُ تَفْصِيلًا ۝

(૧૨) અને અમોએ રાત્રિ તથા દિવસને (અમારી કુદરતની) બે નિશાનીઓ બનાવી છે પછી અમોએ રાત્રિની નિશાની ઝાંખી કરી નાખી અને અમોએ દિવસની નિશાની પ્રકાશિત કરી દીધી કે જેથી (તેમાં) તમે તમારા પરવરદિગારની કૃપા (રોઝી)ની યાહના કરો, અને વળી એ માટે કે તમે વરસોની ગણતરી તથા હિસાબ સમજો; અને દરેક વસ્તુને અમોએ જોઈએ તેવી ખુલ્લી રીતે વર્ણવી દીધી છે.

وَكُلَّ إِنْسَانٍ أَلْزَمْنَاهُ طَبِيرَهُ فِي عُنُقِهِ ۖ وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ

كِتَابًا يَلْقَاهُ مَنْشُورًا ﴿١٣﴾

(૧૩) અને દરેક ઇન્સાનની કરણીને અમોએ તેના ગળાનો હાર બનાવી છે, અને કયામતના દિવસે અમે તેના માટે એક લખાણ કાઢીશું જેને તે તદ્દન ખુલ્લો નિહાળશે.

إِقْرَأْ كِتَابَكَ ۖ كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا ۝۱۳

(૧૪) (૫છી અમે તેને આજ્ઞા કરીશું કે) તારું લખાણ વાંચી લે; આજના દિવસે તારા પોતાનો હિસાબ લેવાને તું પોતેજ બસ છે.

مِنْ اهْتَدَىٰ فَاِتْمَا يَهْتَدِي لِنَفْسِهِ ۚ وَمَنْ ضَلَّ فَاِتْمَا يَضِلُّ

عَلَيْهَا ۖ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ

نَبْعَثَ رَسُولًا ۝۱۵

(૧૫) જેણે હિદાયત મેળવી તો તેણે પોતાના માટે હિદાયત મેળવી, અને જે ગુમરાહ થઇ ગયો તેની ગુમરાહી (નું માહું પરિણામ) તેના પોતાના માટેજ છે; અને કોઇ બોજો ઊંચકનાર બીજા કોઇનો બોજો ઊંચકશે નહીં; અને જ્યાં સુધી અમે (કોઇ) રસૂલ મોકલતા નથી ત્યાં સુધી અઝાબ આપતા નથી.

وَإِذَا أَرَدْنَا أَنْ نُهْلِكَ قَرْيَةً أَمَرْنَا مُتْرَفِيهَا فَفَسَقُوا فِيهَا فَحَقَّ

عَلَيْهَا الْقَوْلُ فَدَمَّرْنَا فِيهَا تَدْمِيرًا ﴿١٦﴾

(૧૬) અને જ્યારે અમે કોઇ વસ્તીનો નાશ કરવાનો મનસુબો કરીએ છીએ ત્યારે તે વસ્તીના વૈભવશાળી લોકોને (અમારી તાબેદારી કરવાનો) હુકમ કરીએ છીએ, પણ તેઓ તે (વસ્તી)માં

(અમારા હુકમો સંબંધી) નાફરમાની કરવા લાગે છે; એવી રીતે અમારો બોલ તેમના સંબંધમાં સાચો પૂરવાર થઈ જાય છે, જેથી અમે તેનો સંપૂર્ણ નાશ કરી નાખીએ છીએ.

وَ كُمْ أَهْلَكْنَا مِنَ الْقُرُونِ مِنْ بَعْدِ نُوحٍ ط وَ كَفَىٰ بِرَبِّكَ
بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا بَصِيرًا ①

(૧૭) અને નૂહની પછી અમોએ કંઈ કેટલીયે પેઢીઓનો નાશ કરી નાખ્યો; અને તારો પરવરદિગાર પોતાના બંદાઓના ગુનાહોથી સંપૂર્ણપણે માહિતગાર છે અને બધુંજ જોઈ રહ્યો છે.

مَنْ كَانَ يُرِيدُ الْعَاجِلَةَ عَجَّلْنَا لَهُ فِيهَا مَا نَشَاءُ لِمَنْ نُرِيدُ ثُمَّ

جَعَلْنَا لَهُ جَهَنَّمَ ۚ يَصْلَاهَا مَذْمُومًا مَدْحُورًا ﴿١٨﴾

(૧૮) જે (શખ્સ) ક્ષણભંગુર જગતનો ચાહનારો હોય છે તો તેમાંથી જેના માટે અમે જે ચાહીએ છીએ તે જલ્દીથી આપી દઈએ છીએ, પછી અમે તેના માટે જહન્નમ નક્કી કરીએ છીએ, તે તેમાં તિરસ્કારાયેલો અને (અલ્લાહની રહેમતથી) નાસીપાસ થયેલો દાખલ થશે.

وَمَنْ أَرَادَ الْآخِرَةَ وَسَعَىٰ لَهَا سَعْيَهَا وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ كَانَ سَعْيُهُمْ مَشْكُورًا ﴿١٩﴾

(૧૯) અને જે આખેરતનો ઇચ્છનારો થાય છે અને તે પ્રાપ્ત કરવા માટે એવી કોશિશ કરે કે જેવી કોશિશ કરવાનો હક છે એવી સ્થિતિમાં કે તે મોઅમીન પણ હોય તો તે લોકોની કોશિશનો (અવશ્ય) સ્વીકાર થશે.

كُلًّا مُّمَدُّ هُوَ لَاءٍ وَهُوَ لَاءٍ مِنْ عَطَاءِ رَبِّكَ ۖ وَمَا كَانَ عَطَاءُ رَبِّكَ

فَحُظُّورًا ۝۲۰

(૨૦) (અથ રસૂલ!) અમે દરેકની-એમની પણ અને તેમની પણ- તારા પરવરદિગારની બક્ષિસો વડે સહાય કરતા રહીએ છીએ; અને તારા પરવરદિગારની બક્ષિસ કોઈના ઉપર પણ બંધ નથી.

أَنْظُرْ كَيْفَ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَى بَعْضٍ ۖ وَلَئِنَّ خِرَافَةَ الْكُبَرِ
دَرَجَاتٍ وَأَكْبَرُ تَفْضِيلًا ﴿٢١﴾

(૨૧) જો, અમોએ કેવી રીતે કેટલાકોને કેટલાકો પર શ્રેષ્ઠતા આપી છે; અને ખરેખર દરજ્જા અને શ્રેષ્ઠતાના સબંધમાં આખેરત વધુ ઉત્તમ છે.

لَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَهًا آخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَّخْذُومًا ﴿٢٢﴾

(૨૨) અલ્લાહની સાથે કોઈ બીજો માઅબૂદ બનાવ નહિ. નહિ તો બૂરી રીતે બદનામ થઈને ત્યજી દીધેલી (હાલતમાં) બેસી રહીશ.

وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۗ إِنََّّمَا
يَبْلُغُنَّ عِنْدَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَيْهِمَا فَلَا تَقُلْ لَهُمَا أُفٍ
وَلَا تَنْهَرْهُمَا وَقُلْ لَهُمَا قَوْلًا كَرِيمًا ﴿٢٣﴾

(૨૩) અને તારા પરવરદિગારે હુકમ આપી દીધો છે કે તમે તેના સિવાય બીજા કોઈની ઇબાદત કરો નહિ અને માબાપ સાથે નેકી કરતા રહો. અગર તેઓ બન્નેમાંથી એક અથવા બન્ને તારી સામે વૃદ્ધાવસ્થાએ પહોંચી જાય (અને કોઈ કારણે તારા ઉપર ક્રોધે ભરાય) તો તેમની સામે ઉફ પણ ન કર, તેમજ તેમને તરછોડ પણ નહિ, અને તેમની સાથે માયાળુપણે વાત કર.

وَاحْفَظْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُلْ رَبِّ ارْحَمْهُمَا
كَمَا رَبَّبَّنِي صَغِيرًا ۝

(૨૪) અને તેમની પાસે નમ્રતાનો બાજુ માયાળુપણે ઝૂકાવ અને આ કહ્યા કર કે અથ મારા પરવરદિગાર! આ બન્ને ઉપર એવીજ કૃપા ફરમાવ જેવી કે આ બન્નેએ મને નાનપણથી ઉછેરવામાં (કૃપા) કરી હતી.

رَبُّكُمْ أَعْلَمُ بِمَا فِي نُفُوسِكُمْ ۝ إِنَّ تَكُونُوا صٰلِحِينَ فَإِنَّهُ كَانَ
لِلّٰوَابِئِن غَفُورًا ۝

(૨૫) તમારો પરવરદિગાર તમારા અંતઃકરણોમાં જે કાંઈ છે તેનાથી સારી રીતે વાકેફ છે; અગર તમે

સદાચારી રહેશો તો બેશક તે પણ (પોતાની તરફ)
વારંવાર રજૂ થનારાઓને અતિ માફ કરનાર છે.

وَأْتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ وَلَا تَبْذُرْ

تَبْذِيرًا ③

(૨૬) અને તું નજીકના (સગાં-વહાલાં)ઓને તેમનો
હક આપી દે તેમ નિરાધારો તથા મુસાફરોને પણ,
અને ઉડાઉપણે ખર્ચ ન કર.

إِنَّ الْمُبْذِرِينَ كَانُوا إِخْوَانَ الشَّيْطَانِ ۗ وَكَانَ الشَّيْطَانُ

لِرَبِّهِ كَفُورًا ④

(૨૭) નિઃસંશય ઉડાઉ ખર્ચ કરનારા શૈતાનોના ભાઈઓ છે; અને શૈતાન પોતાના પરવરદિગારનો હંમેશથી અનુપકારી છે.

وَأَمَّا تُعْرَضُونَ عَنْهُمْ أِبْتِغَاءَ رَحْمَةٍ مِّن رَّبِّكَ تَرْجُوهَا فَقُلْ لَّهُمْ قَوْلًا مَّيْسُورًا ﴿٢٨﴾

(૨૮) અને અગર તું તારા પરવરદિગારની કૃપા પ્રાપ્ત કરવા માટે કે જેની તું આશા રાખે છે તેની રાહ જોતાં તેમનાથી મોંઢું ફેરવવું પડે તો (જ્યારે તું તેમની પાસે પાછો ફરે ત્યારે) તેમને નરમ શબ્દોથી સમજાવી લે.

وَلَا تَجْعَلْ يَدَكَ مَغْلُولَةً إِلَىٰ عُنُقِكَ وَلَا تَبْسُطْهَا كُلَّ الْبَسْطِ
فَتَقْعَدَ مَلُومًا ۝٢٩

(૨૯) અને તું તારો હાથ ગરદન સાથે બાંધેલો ન
રાખ તેમજ એકદમ હાથ લંબાવ પણ નહિ કે જેથી
ઠપકાને પાત્ર અને ઓશીયાળો બની જાય.

إِنَّ رَبَّكَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۗ إِنَّهُ كَانَ بِعِبَادِهِ
خَبِيرًا بَصِيرًا ۝٣٠

(૩૦) નિ:સંશય તારો પરવરદિગાર જેના માટે
ચાહે છે રોઝી વિશાળ કરી દે છે અને (જેના માટે
ચાહે છે) તંગ કરી નાખે છે; નિ:સંશય તે પોતાના

બંદાઓની (દરેક) સ્થિતિથી માહિતગાર અને નિહાળનારો છે.

وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ خَشْيَةَ إِمْلَاقٍ ۖ نَحْنُ نَرْزُقُهُمْ
وَأَيَّاكُمْ ۖ إِنَّ قَتْلَهُمْ كَانَ خِطْأً كَبِيرًا ۝۳۱

(૩૧) અને ભૂખમરાના ભયથી તમારી ઔલાદને મારી ન નાખો; (કારણ કે) તેમને પણ અમેજ રોઝી આપીએ છીએ અને તમને પણ; બેશક તેમને મારી નાખવું (એ) ઘણોજ મોટો ગુનોહ છે.

وَلَا تَقْرَبُوا الزَّيْنَىٰ إِنَّهُ كَانَ فَاحِشَةً ۖ وَسَاءَ سَبِيلًا ۝۳۲

(૩૨) અને વ્યભિચાર પાસે (હરગિજ) ન જાઓ
નિઃસંશય તે નિર્લજ્જપણા (નું કાર્ય) છે; અને અતિ
બૂરો માર્ગ છે.

وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ط وَمَنْ قُتِلَ
مَظْلُومًا فَقَدْ جَعَلْنَا لَوْلِيَيْهِ سُلْطٰنًا فَلَا يُسْرِفُ فِي الْقَتْلِ ط
إِنَّهُ كَانَ مَنصُورًا ﴿٣٣﴾

(૩૩) અને જે કોઈ જીવ કે જેનું મારી નાખવું
અલ્લાહે હરામ કર્યું છે તેને અન્યાયી રીતે મારી ન
નાખો સિવાય કે ન્યાયી રીતે; અને જે કોઈ નિર્દોષ
(હોવા છતાં) માર્યો જશે તો અમે તેના વારસને
અવશ્ય સત્તા આપીશું, પણ તે ખૂન (નો બદલો

લેવા)માં હદ બહાર જાય નહિ; (કેમકે) નિ:સંશય તેને સહાય કરવામાં આવી છે.

وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ

أَشُدَّهُ ۖ وَأَوْفُوا بِالْعَهْدِ ۗ إِنَّ الْعَهْدَ كَانَ مَسْئُولًا ﴿٣٧﴾

(૩૪) અને યતીમના માલ પાસે સદ્દેતુ સિવાય જાઓ નહિ, જ્યાં સુધી કે તે બાલીગ (ઉંમર લાયક) થઈ ન જાય; અને આપેલા વાયદા પૂરા કરો, નિ:સંશય દરેક વાયદા સંબંધી સવાલ કરવામાં આવશે.

وَأَوْفُوا الْكَيْلَ إِذَا كِلْتُمْ وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ ط

ذَلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا ﴿٣٥﴾

(34) અને જ્યારે માપ કરો ત્યારે માપ પૂરું આપો અને સાચા ત્રાજવાં વડે જોખો; એજ (તમારા માટે) સારું છે અને પરિણામે પણ તે બેહતર છે.

وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ ۗ إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ
كُلُّ أُولَئِكَ كَانَ عَنْهُ مَسْئُولًا ﴿٣٤﴾

(35) અને જે વાતની તને જાણ ન હોય તેની પાછળ ન પડ; નિ:સંશય કાન તથા આંખ તથા અંત:કરણ એમાંથી દરેકને (કયામતના દિવસે) સવાલ કરવામાં આવશે.

وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۚ إِنَّكَ لَنْ تَخْرِقَ الْأَرْضَ وَلَنْ
تَبْلُغَ الْجِبَالَ طُولًا ﴿٣٥﴾

(૩૭) અને જમીન પર અકડીને ન ચાલ, નિઃસંશય તું ન તો જમીનને (તારી અકડાઇથી) ફાડી શકશે અને ન (ઊંચો) વધીને પહાડોની ઊંચાઇએ પહોંચી શકશે.

كُلُّ ذَلِكَ كَانَ سَيِّئُهُ عِنْدَ رَبِّكَ مَكْرُوهًا ﴿٣٨﴾

(૩૮) આ માંહેની દરેક વાતની બૂરાઇ તારા પરવરદિગાર આગળ નાપસંદ છે.

ذَلِكَ هِمًّا أَوْ حِي إِلَيْكَ رَبُّكَ مِنَ الْحِكْمَةِ ۗ وَلَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَهًا آخَرَ فَتُلْقَى فِي جَهَنَّمَ مَلُومًا مَدْحُورًا ﴿٣٩﴾

(૩૯) (અથ રસૂલ!) જે ડહાપણની વાતો તારા પરવરદિગારે તારી તરફ વહી દ્વારા ઉતારી છે તે

માંહેની આ (વાતો) છે; અને તું અલ્લાહની સાથે બીજો માઅબૂદ બનાવી ન લે નહિ તો (અય મનુષ્ય!) ઠપકાને પાત્ર બનીને (રહેમતથી) દૂર કરી જહન્નમમાં નાખી દેવામાં આવશે.

أَفَأَصْفُكُمْ رَبُّكُمْ بِالْبَنِينَ وَالنَّكْحَانَ إِنَّا نَحْنُ وَإِنَّكُمْ لَتَقُولُونَ قَوْلًا عَظِيمًا ۝

(૪૦) (અય મુશરીફો!) ત્યારે શું બેટાઓ (આપવા) માટે તમારા અલ્લાહે તમનેજ ચૂંટી કાઢ્યા છે પોતાના માટે ફરિશ્તાઓમાંથી બેટીઓ લઈ લીધી છે? ખરેજ તમે આ ભારે બોલ બોલો છો.

